

ત્વરિત જાહેરાત માટે

## સીટીને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માટે 2022 નો બિઝનેસ એક્સિલન્સ એવોર્ડ મળ્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 9, 2022) – ધી બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડે તાજેતરમાં પોતાના 2022 બિઝનેસ એક્સિલન્સ એવોર્ડ્સ ગાલાનું આયોજન કર્યું, જ્યાં સીટી ઓફ બ્રેમ્પટનને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માટે તેઓના સમર્પણ અને પોતાના બસોના કાફલાનું (ફ્લીટ્સનું) ઇલેક્ટ્રિકીફિકેશન કરવાના કામ માટે સ્માર્ટ સોલ્યુશન્સ શ્રેણી હેઠળ એવોર્ડ મળ્યો.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સંખ્યાબંધ નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી છે, જેમાં પાન-કેનેડિયન બેટરી ઇલેક્ટ્રિક બસ (BEB) ડેમોન્સ્ટ્રેશન એન્ડ ઇન્ટિગ્રેશન ટ્રાયલના ભાગરૂપે તેની BEB ટ્રાયલ (અજમાયશ)નો તબક્કો 1 ની શરૂઆત, બ્રેમ્પટન સીટી કાઉન્સિલની સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકાઈઝ નવી ત્રીજી ટ્રાન્ઝિટ સગવડને સમર્થન અને સૌથી તાજેતરમાં, કેનેડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક (CIB) સાથે ધિરાણ વ્યવસ્થાનો સમાવેશ થાય છે, જેઓ બ્રેમ્પટનને અત્યારે અને વર્ષ 2027 વચ્ચે 450 જેટલી BEBs ખરીદવામાં સહાયરૂપ થવા \$400M સુધીનું રોકાણ પૂરું પાડશે.

સ્માર્ટ સોલ્યુશન્સ એવોર્ડથી ડિજિટલ પરિવર્તનમાં ઉપલબ્ધિ અને ઉત્કૃષ્ટતા માટે સંસ્થાઓને ઓળખ મળે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ કાર્યક્ષમતા સુધારવાના હેતુસર, સમુદાય માટે મૂલ્ય અને છેવટે વિકાસ પૂરો પાડવા પરિવહન ક્ષેત્રમાં સતત ફેરફારોને પ્રતિભાવ આપ્યો, નવી અને નવીન ટેકનોલોજીનું સંશોધન, શોધ અને અમલમાં મૂકી તે બદલ તેઓને ઓળખ મળી હતી. [વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો.](#)

### અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ પાસેથી બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માટે 2022 નો બિઝનેસ એક્સિલન્સ એવોર્ડ મળવા બદલ સીટી ઓફ બ્રેમ્પટન સન્માનિત અનુભવે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ એ ટ્રાન્ઝિટ સ્પેસમાં ડિજિટલ પરિવર્તનમાં, સતતપણે નવીન શોધ કરવામાં અને આપણાં શહેરને ચલાવવામાં રાખવા ઉત્કૃષ્ટ સર્વિસ પૂરી પાડવામાં અગ્રેસર છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“2022 બિઝનેસ એક્સિલન્સ એવોર્ડ્સમાં સ્માર્ટ સોલ્યુશન્સની શ્રેણી હેઠળ બ્રેમ્પટન ટ્રાન્ઝિટને ઓળખ અપાવવા બદલ બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડનો આભાર. આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ ટેકનોલોજીમાં હરણફાળ ભરીને ભાવિ ઘડી રહી છે, જે અન્ય મ્યુનિસિપલિટીસ માટેના માર્ગની આગેવાની કરે છે અને બ્રેમ્પટનને રહેવા, કામ કરવા અને રમતો રમવા વધારે સારું સ્થળ બનાવે છે.”

- પૉલ વિસેન્ટ (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન ટ્રાન્ઝિટ વતી, સ્માર્ટ સોલ્યુશન્સમાં આ ઓળખ આપણને અપાવવા બદલ હું બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને ખરેખર ગૌરવ થાય છે કે આપણી ટીમે ઉદ્યોગ અગ્રેસર બનવાનું ચાલુ રાખ્યું છે – વિકાસ, ડિજિટલ નવીન શોધ અને પર્યાવરણલક્ષી કાયમીપણને સંતુલિત કરીને આપણાં ગ્રાહકોને સર્વિસમાં ઉત્કૃષ્ટતા પહોંચાડે છે. આપણે ભાવિ પર નજર કરીએ ત્યારે, આપણે વિકસવાની રીત ઘડવા અને આપણાં સમુદાયને સેવા પહોંચાડવા મદદરૂપ થવા આપણાં સ્થાનિક ધંધાઓની જેમ બધાં હિતધારકોના સહયોગ પર આપણે અવલંબિત હોઈએ છીએ. આ સન્માન બદલ ફરીથી આપનો આભાર અને અમે આપણી સતત ભાગીદારી માટે આશાવાદી છીએ.”

- એલેક્સ મિલોજેવિક (Alex Milojevic), જનરલ મેનેજર, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી કર્મચારીઓ પરિવહન ક્ષેત્રમાં સતત ફેરફારોને પ્રતિભાવ આપવા સમર્પિત છે જેથી કરીને આપણે ભાવિ માટે તૈયાર રહીએ. આપણે નવીન શોધને કટિબદ્ધ છીએ, અને સીટી ઓફ બ્રેમ્પટન અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ડિજિટલ પરિવર્તનમાં સ્માર્ટ સોલ્યુશન્સ માટે 2022 નો બિઝનેસ એક્સિલન્સ એવોર્ડ મળવા બદલ ગૌરવ અનુભવે છે.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઇન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડામાં સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકી એક, બ્રેમ્પટન 7,00,000 લોકો અને 75,000 ધંધાઓનું ઘર છે. આપણે જે કંઈ કરીએ છીએ તે લોકોના હૃદયમાં વસે છે. આપણને આપણાં વૈવિધ્યસભર સમુદાયોથી સ્ફૂર્તિ મળે છે; આપણે રોકાણ આકર્ષીએ છીએ, અને આપણે ટેકનોલોજીલક્ષી અને પર્યાવરણલક્ષી નવીન શોધની આગેવાની કરવાનું કામ હાથમાં લઈએ છીએ. આપણે પ્રગતિ સાધવા ભાગીદારી કરીને એવું આરોગ્યપ્રદ શહેર નિર્માણ કરીએ છીએ જે સુરક્ષિત, કાયમી અને સફળ રહે. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાઈ જાવ. વધુ માહિતી અહીં મેળવો, [www.brampton.ca](http://www.brampton.ca)

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)